

ત્વરિત જાહેરાત માટે

સિટીએ રિક્સ 407 સ્પોર્ટ્સ પાર્કનું નામ બદલીને ઇમેન્સિપેશન પાર્ક કર્યું છે અને ઓગસ્ટને બ્રમ્પટનમાં ઇમેન્સિપેશન (મુક્તિ) માસ તરીકે જાહેર કર્યો છે

બ્રમ્પટન, ઓન્ટારિયો (01 ઓગસ્ટ 2020) – જુલાઈ 8 ના રોજ બ્રમ્પટન સીટી કાઉન્સિલે ગુલામીની નાબૂદીના માનમાં રિક્સ 407 સ્પોર્ટ્સ પાર્કનું નામ બદલીને ઇમેન્સિપેશન પાર્ક કરવાનો ખરડો સર્વસંમતિથી પસાર કર્યો. ખરડાની કલ્પના સીટી કાઉન્સિલર શેરમેન વિલિયમ્સ (Charmaine Williams)ની રહી અને તેનું અનુમોદન કાઉન્સિલના તમામ સભ્યોએ કર્યું. આ વર્ષે, ઓગસ્ટ 1 ઇમેન્સિપેશન ડે તરીકે ઘોષીત થયો અને ઓગસ્ટને બ્રમ્પટન ખાતે ઇમેન્સિપેશન માસ તરીકે ઘોષીત કરવામાં આવ્યો છે.

ઇમેન્સિપેશન પાર્ક

રિક્સ 407 સ્પોર્ટ્સ પાર્કનું નામ બદલીને ઇમેન્સિપેશન પાર્ક કરવામાં આવ્યું છે. આ પાર્ક જે વોર્ડ 7માં હાઈવે 407ના દક્ષિણે સ્થિત છે તે 2004 માં બંધાયો હતો અને તેમાં નાની અને મોટી સોકર પીચ અને ક્રિકેટના મેદાનોનો સમાવેશ થાય છે.

મેયર પેટ્રિક બ્રાઉન (Mayor Patrick Brown) અને કાઉન્સિલરો ઓગસ્ટમાં પાર્કના નવા નામની તકતીનું અનાવરણ કરશે.

ઇમેન્સિપેશન માસ

ઓગસ્ટ 1 ઇમેન્સિપેશન ડે છે અને ઓગસ્ટ બ્રમ્પટન ખાતે ઇમેન્સિપેશન માસ છે. સીટી ઓફ બ્રમ્પટન બ્રમ્પટનના વૈવિધ્યને બિરદાવવા અને આખા ઓગસ્ટ માસ દરમિયાન પ્રસંગો યોજીને આ મહત્વના દિવસ ને મહિનાને પ્રતિબદ્ધ છે. COVID-19 નો ફેલાવો થતો રોકવા માટે તમામ ઇવેન્ટ્સ ઓનલાઈન યોજાશે. ઇવેન્ટની સંપૂર્ણ યાદી માટે અહીં મુલાકાત લો www.brampton.ca

ઇમેન્સિપેશન ડેના ઉપક્રમે ઓગસ્ટ 1ના રોજ ઓનલાઈન ધ્વજરોહણો થશે, ઓગસ્ટ 6 ના રોજ જમાઈકી સ્વતંત્રતા દિન નિમિત્તે, ઓગસ્ટ 22ના રોજ ડોમિનિકન રિપબ્લિક રિસ્ટોરેશન દિન નિમિત્તે અને ઓગસ્ટ 31ના રોજ ટ્રિનિડેડ અને ટોબાગો સ્વતંત્રતા દિન નિમિત્તે. તમામ ઓનલાઈન ધ્વજરોહણોની વિધિઓ ઓનલાઈન [અહીં](#) ઉપલબ્ધ રહેશે.

બ્રમ્પટનની અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત રંગભેદ વિરોધી રંગભેદ યુનિટ

10 જૂન 2020ના રોજ, સીટી કાઉન્સિલે અશ્વેત આફ્રિકન અને કેરિબિઅન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત રંગભેદ વિરોધી રંગભેદ યુનિટને મંજૂરી આપી. ધ્વજરોહણ યોજવા મુખ્ય વહીવટી અધિકારીના નેજા હેઠળ યુનિટ તે એકમની સ્થાપનાને

મદદરૂપ થઈને તેની દોરવાણી કરશે તથા બ્રેમ્પટનમાં ઘર કરી ગયેલ અશ્વેત વિરોધી રંગભેદને નાબૂદ કરવા માટેની કાર્ય યોજનાનો વિકાસ કરશે. સ્થાનિક સમૂદાયના હિસ્સાધારકોના માર્ગદર્શન હેઠળ કાર્ય મુખ્યત્વે બ્રેમ્પટનના અશ્વેત સમાજની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

સિટી જેમ જેમ અશ્વેત વિરોધી રંગભેદ યુનિટનો વિકાસ કરશે ત્યારે વધુ જાણકારી મેળવવા માટે અને તેમા સામેલ થવામાં પોતાની રૂચિ દર્શાવવા કૃપા કરી અહીં સિટીનો સંપર્ક કરો AntiBlackRacismUnit@brampton.ca.

અવતરણો

"આખા વિશ્વમાં આપણે સમયની એક ઐતિહાસિક ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ. અશ્વેત રંગભેદનો સહિયારો સામનો તમામ પૃથ્થભૂ ધરાવતા લોકો ભેગા મળીને કરવા જઈ રહ્યા છે. અહીં બ્રેમ્પટન ખાતે ઈમેન્સિપેશન માસનું સન્માન અને સિટી પાર્કને ઈમેન્સિપેશન પાર્ક જેવું નવું નામ આપવું તે અમારે માટે એક શક્તિશાળી માર્ગ છે જેનાથી ભૂતકાળનો સ્વીકાર કરી શકાય અને ભારપૂર્વક પુનરુચ્ચારણ કરીએ છીએ કે અમે બ્રેમ્પટનના અશ્વેત સમાજની સાથે છીએ.

- પેટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

"બ્રેમ્પટનના ઈતિહાસમાં સિટી કાઉન્સિલમાં ચૂંટાયેલ પ્રથમ અશ્વેત મહિલા તરીકે મને 2019ના ઓક્ટોબરમાં ઈમેન્સિપેશનને માન્યતા આપતો ખરડો પ્રસ્તાવિત કરવાનું ગૌરવ છે. મે જ્યારે આ પહેલને રજૂ કરી ત્યારે કલ્પના પણ ન થઈ શકે તેમ હતી કે તાજેતરની ઘટનાઓ અશ્વેત વિરોધી રંગભેદની આપણી સમજણ કેટલી ઉન્નત કરી શકે છે. જોકે, મને તે જણાવતા અતિશય ગર્વની લાગણી થાય છે કે ઈમેન્સિપેશન પાર્ક બ્રેમ્પટનમાં છે. મને જાણ છે ત્યાં સુધી તો આખા કેનેડામાં આ સહુ પ્રથમ ઈમેન્સિપેશન પાર્ક છે. હું વધુને વધુ આ પ્રકારની પહેલો જોવા ઉત્સુક છું જે અશ્વેત વિરોધી રંગભેદના મૂળની આણી ઐતિહાસિક સમજણ વધારે જ્યારે આપણે એવા દરેક અંતરાયો તોડી પાડવા સજ્જ થઈએ છીએ જે માનવ સંભાવનાઓને સીમિત કરતા હોય.

- શેરમેન વિલિયમ્સ સીટી કાઉન્સિલર, વોર્ડ 7& 8

"ગત મહિને સિટી કાઉન્સિલે અશ્વેત આફ્રિકન અને કેરિબિયન સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક સશક્તિકરણ અને અશ્વેત રંગભેદ વિરોધી રંગભેદ યુનિટના સર્જનની મંજૂરી આપી જેથી બ્રેમ્પટનના અશ્વેત સમાજ સાથે સંપર્ક સાધી શકાય અને તેમની સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પરિસ્થિતિઓ સુધારી શકાય. અને હવે માત્ર એક જ મહિનામાં અમે આપણા ઈતિહાસના આ મહત્વના હિસ્સાને પ્રકાશિત કરવા માટે અમે કમ્યુનિટી પાર્કનું નામ બદલી રહ્યા છીએ. આગળ વધતા, અમે અશ્વેત સમાજની જરૂરિયાતોને સંબોધિત કરવા તેમની સાથે કાર્ય કરતા રહીશું."

- પેટ ફોર્ટિની, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 7& 8

"ઈમેન્સિપેશન માસનું સન્માન અને બ્રેમ્પટન ઈમેન્સિપેશનના ભાગનું નામકરણ કરવું તે બ્રેમ્પટન માટે નોંધપાત્ર ઉન્નતિના સોપાન ગણી શકાય. લોકો માટે ઈતિહાસ જાણવો મહત્વનો છે અને તે જાણવું કે કેનેડામાં આપણે ત્યાં પણ ગુલામી હતી. પાર્કનું પુનઃનામકરણ જેવા અભિયાનો મને ખૂબ વિશ્વાસ અપાવે છે કે અમે બ્રેમ્પટનમાં ખૂબ પ્રગતિ કરી શકીશું."

- િવનેથ એપમેન, વરિષ્ઠ સલાહકાર, આર્થિક સશક્તિકરણ અને અશ્વેત વિરોધી રંગભેદ (Economic Empowerment and Anti-Black Racism), સીટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

મોનિકા ડુગ્ગલ (Monika Duggal)

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca